

## કાયદા અધિકારીની કરાર આધારિત નિમણૂક માટેની શરતો અને બોલીઓ

૧. કાયદા અધિકારીની જગ્યા માટે ઉમેદવારી કરનાર પાસે ઓછામાં ઓછો ૭ વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ હોવો અનિવાર્ય છે.
૨. ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી ધરાવતો હોવો જોઈએ.
૩. કાયદા અધિકારીની નિમણૂક તેઓ જે તારીખે ફરજ પર હાજર થાય તે તારીખથી અગિયાર માસ અથવા જગ્યાની મુદત સુધીની રહેશે.
૪. નિમણૂક કરનાર અને નિમણૂક પામનાર બંને પક્ષો એક માસની નોટીસ આપીને આ નિયુક્તિનો અંત લાવી શકશે.
૫. કાયદા અધિકારીને આ જગ્યા પર રૂ.૪૦,૦૦૦/- ના એકત્રિત વેતન પર કોઈપણ જાતના ભથ્થા મળવાપાત્ર થશે નહીં.
૬. કરારના સમય દરમિયાન તેઓને એકત્રિત વેતનમાં કોઈપણ પ્રકારનો વધારો કે ઇજાફો મળવાપાત્ર થશે નહીં તથા મોંઘવારી ભથ્થુ, વચગાળાની રાહત તથા બીજા લાભો મળવાપાત્ર થશે નહીં.
૭. કરારના સમયગાળા દરમિયાનની નોકરી બદલ પેન્શન, બોનસ, એલ.ટી.સી, એન્કેશમેન્ટ ઓફ લીવ, પેશગી કે તેવા અન્ય નાણાંકીય લાભો મળવાપાત્ર થશે નહીં.
૮. કરારના સમયગાળા દરમિયાન તેઓનું અવસાન થાય તો તેમણે બજાવેલ સમયગાળાની એકત્રીત લેણી રકમ તેઓના કુટુંબીજનોને મળવાપાત્ર થશે. બીજા કોઈ નાણાંકીય લાભ, એક્ષ ગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી જેવા આનુષંગિક લાભ મળવાપાત્ર થશે નહીં.
૯. કાયદા અધિકારીએ સમાન સંવર્ગના અધિકારીએ જે ફરજ બજાવવાની થતી હોય તેવી ફરજો બજાવવાની રહેશે.તેવા અધિકારીઓ માટે કચેરીમાં ફરજ પાલન માટે જે સમય નિયત કરેલ હોય તે સમયપ્રમાણે કરાર આધારિત અધિકારીએ પણ કચેરીમાં હાજરી આપવાની રહેશે.
૧૦. કાયદા અધિકારીએ કાર્ય મથક પર રહેઠાણ રાખવાનું ફરજિયાત રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર તેઓ મુખ્ય મથક છોડી શકશે નહીં. (સરકારી કામ માટે તેઓ ચોવીસ કલાક બંધાયેલા છે અને સરકારને તેમની સેવાની જરૂર પડે ત્યારે તેમણે અચૂક હાજર રહેવાનું રહેશે)
૧૧. કાયદા અધિકારીને સરકારી કામે પ્રવાસ પર જવાનું થાય તો સરકારશ્રીના વર્તમાન ધોરણે મુજબ મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળવાપાત્ર રહેશે.

૧૨. કરાર આધારિત કાયદા અધિકારીએ રાજ્ય વેરા કમિશનર કચેરી હેઠળના ૧૧ વિભાગો અને અમદાવાદ હેડક્વાર્ટર ખાતે જે પણ કચેરીમાં કે હેડક્વાર્ટર ખાતે ફરજ સોંપાય તેમણે તે સ્થળે ફરજ બજાવવાની રહેશે.
૧૩. કાયદા અધિકારીને ગુજરાત સહવિલ સર્વીસીસ (કન્કટ) ૧૯૭૧માં ઠરાવેલ બાબતો બંધનકર્તા રહેશે અને તેનો ભંગ થયે કરારનો સમય કોઈપણ જાતની કાર્યવાહી વગર સમાપ્ત કરી શકાશે.
૧૪. તેઓને ૧૧ (અગિયાર) માસ દરમિયાન અગિયાર (૧૧) પરચુરણ રજા મળવાપાત્ર થશે અન્ય કોઈ રજા મળવાપાત્ર થશે નહીં.
૧૫. કાયદા અધિકારીએ તેઓને મળનાર એકત્રિત વેતનની ત્રણ ગણી રકમનો બોન્ડ આપવાનું રહેશે.
૧૬. તેઓને ગુજરાત સિવિલ સર્વીસીસ(કન્કટ) રૂલ્સ-૧૯૭૧માં ઠરાવેલ બાબતો બંધનકર્તા રહેશે અને તેનું ભંગ થયેલ કરારનું સમય કોઈપણ જાતની કાર્યવાહી વગર સમાપ્ત કરી શકાશે.
૧૭. કાયદા અધિકારીએ દર મહિને કેટલા કેસોમાં હાજર રહ્યા, કેટલા કોર્ટ કેસોનો નિકાલ થયો તે પૈકી કેટલા કેસોમાં સરકાર પક્ષે તેમજ કેટલા કેસોમાં સરકાર વિરુદ્ધ ચુકાદા આવ્યા તેની કોર્ટ/કેસવારની ચોક્કસ માહિતી સંયુક્ત વાણિજ્યિક વેરા કમિશનર, અદાલત શાખાને અચુક રજુ કરવાની રહેશે.
૧૮. નિમણૂક પત્ર મળ્યા તારીખથી દિન-૭ માં વિભાગમાં ફરજ પર હાજર થવાનું રહેશે. જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ જશે તો તેઓને આ નિમણૂક સ્વીકાર્ય નથી તેમ ગણીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
૧૯. કરારના સમયગાળા દરમિયાન અન્ય જે કોઈ અગત્યની માહિતી વેરા વિભાગ સંબંધિત તેમની ધ્યાનમાં કે જાણમાં આવે તે માહિતી કાયદા અધિકારી ખુલ્લી કરશે નહીં, પ્રગટ કરશે નહીં કે જાહેર કરશે નહીં. પોતે જે માહિતી વેરા વિભાગ સાથેના સમયગાળા દરમિયાન પ્રાપ્ત કરે તે અંગે તેમણે ગુપ્તતા જાળવવાની છે.

અરજી પત્રક

પ્રતિ,  
નાયબ રાજ્યવેરા કમિશનરશ્રી (મહેકમ)  
રાજ્યકર ભવન, આશ્રમ રોડ,  
અમદાવાદ.

ઉમેદવારનો  
તાજેતરનો  
પાસપોર્ટ  
સાઇઝનો ફોટો

વિષય: કાયદા અધિકારીની કરાર અધારિત જગ્યા માટે ઉમેદવારી નોંધવાવા બાબત.

૧	અરજદારનું પુરુ નામ:	અટક	નામ	પિતા/પતિનું નામ
૨	પત્ર વ્યવહારનું સરનામું ટેલીફોન નંબર			
૩	જન્મ તારીખ			
૪	ઉંમર			
૫	શૈક્ષણિક લાયકાત			
	ક્રમ	પદવી	માન્ય યુનિવર્સિટીનું નામ	પાસ કર્યાનું વર્ષ
૬	અન્ય લાયકાત			
૭	બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવ્યા તારીખ			
૮	અનુભવ			

## બાહેંધરીપત્ર

આથી હું.....જાહેર  
કરું છું કે ઉપર દર્શાવેલ વિગતો સંપૂર્ણપણે સત્ય છે. જો ખોટી કે ગેરમાર્ગે દોરનારી જણાશે  
તો નાયબ રાજ્યવેરા કમિશનરશ્રી(મહેકમ), રાજ્યવેરા વિભાગનો નિર્ણય મને બંધનકર્તા  
રહેશે.

અરજી કર્યા તારીખ:

ઉમેદવારની સહી.....